

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન

વહીવટી ખાતુ
(પૂર્વ ઝોન)

માહીતી અધિકાર અધિનિયમ ૨૦૦૫ ની
કલમ ૪ (૧) અન્વયે

વહીવટી (પૂર્વઝોન)
અમદાવાદમ્યુનિસિપલ કોર્પોરેશનનું પ્રોએક્ટીવ ડિસ્કલોજર

અમદાવાદ ભ્યુનિસિપલ કોર્પોરેશન

વહીવટી ખાતુ

(પૂર્વઝોન)

પૂર્વઝોન : વિભાગીય ડેપ્યુટી ભ્યુનિસિપલ કમિશનરશ્રીની કચેરી


(ઓફિસ : પૂર્વઝોનલ ઓફિસ, હરુભાઈ મહેતા ભવન, વિરાટનગર ચાર રસ્તા, નિકોલ, અમદાવાદ-૧૫

ફોન નંબરો : ૨૨૭૦૪૨૨, ૨૨૮૭૦૪૨૩, ૨૨૮૭૦૩૫૭,

| નામ અને હોદ્દો | ટેલીફોન નંબર ઓફિસ | ટેલીફોન નંબર રહેઠાણ |
|---|-------------------|---------------------|
| શ્રી હિલિપ એસ. ગોર ડ. ભ્યુ. કમિશનર (પૂર્વઝોન) અપીલ અધિકારીશ્રી (જોન લેવલની માહીતી માટે) | ૨૨૮૭૦૩૦૦, | ૮૩૨૭૦૩૮૭૨૦ |
| આસી. ભ્યુનિસિપલ કમિશનર (પૂર્વઝોન) જગ્યા ખાલી | ૨૨૮૭૦૪૨૨ | |
| વહીવટી શાખા શ્રી કે. આર. ડાભી આસી. મેનેજર જાહેર માહીતી અધિકારી (જોન લેવલની માહીતી માટે) | ૨૨૮૭૦૪૨૨ | ૮૩૨૭૫ ૫૪૮૦૮ |

વહીવટી માળખું


ડ. ભૂનિસિપલ કમિશર(પૂર્વ જોન)




આસી. ભૂનિસિપલ કમિશર (પૂર્વ જોન)



આસી. મેનેજર - વહીવટ



સીનીયર કલાર્ક



જુનીયર કલાર્ક

વહીવટી શાખા - પૂર્વઝોન

પૂર્વઝોન વહીવટી શાખામાં નીચે મુજબની કામગીરીનું સંચાલન થાય છે.
તમામ કામકાજનાં દિવસોએ સવારે ૧૦-૩૦ થી સાંજે ૬-૧૦ સુધી ઓફિસ ચાલુ રહે છે.

પૂર્વઝોન વિભાગ ડે.ભ્યુનિ.કમિશનરશ્રી(પૂર્વઝોન)ની સીધી દેખરેખ હેઠળ અને તેઓના તાબા હેઠળ આસી.ભ્યુનિ.કમિશનરશ્રી(પૂર્વઝોન), આસી.મેનેજરશ્રી(વહીવટ-પૂર્વઝોન) તથા અન્ય કર્મચારીશ્રીઓ ફરજ બજાવે છે.

પૂર્વઝોનના વહીવટી વિભાગ ઝોન લેવલે વહીવટી સંબંધિત ફરજો તથા સંકલનની કામગીરી તથા ડે.ભ્યુનિ.કમિશનરશ્રી (પૂર્વઝોન) દ્વારા વખતો વખત સોપવામાં આવતી ફરજો બજાવે છે.

પૂર્વઝોન વહીવટી વિભાગમાં પૂર્વઝોનમાં રેવન્યુ તથા કેપીટલ બજેટના અભિપ્રાય આપીને નોંધવાની તથા પૂર્વઝોનના માની.ભ્યુનિ.કાઉન્સીલરશ્રીઓ દ્વારા જે બજેટ ફાળવવામાં આવે તે બજેટ નોંધવાની કામગીરી કરવામાં આવે છે. ભ્યુનિ.કમિશનરશ્રી, ડે.ભ્યુનિ.કમિશનરશ્રી(પૂર્વઝોન), આસી.ભ્યુનિ.કમિશનરશ્રી(પૂર્વઝોન) અને એડી.સી.ટી.ઈજનેરશ્રી (પૂર્વઝોન) દ્વારા આપવામાં આવતી મંજુરીના ઠરાવ પાડવાની તેમજ પૂર્વઝોન દ્વારા કવોટેશન, ઓફર તથા ટેન્ડરથી થયેલ કામોના બુક કરવામાં આવેલ અંદાજ અગેના ૭૩-૩૧ના રીપોર્ટ અંગેની કામગીરી કરવામાં આવે છે.

પૂર્વઝોનના ડે.ભ્યુનિ.કમિશનરશ્રી(પૂર્વઝોન) તથા આસી.ભ્યુનિ.કમિશનરશ્રી (પૂર્વઝોન)ને સંબોધીને આવતા પત્રો, ફાઇલો, ઈન્વર્ક તથા આઉટવર્કની કામગીરી તથા પૂર્વઝોનના ડે.ભ્યુનિ.કમિશનરશ્રીની ઓફિસ તથા પૂર્વઝોનના જુદા જુદા ખાતાઓની ઈભ્રેશ કેશ ચુકવવાની તથા તે બીલોની જમા ખર્ચી કરવાની કામગીરી કરવામાં આવે છે.

પૂર્વઝોન વહીવટી વિભાગમાં ઝોન લેવલે કરવામાં આવતા જાહેર સુખાકારી કામોના રેવન્યુ, કેપીટલ, ઝોનલ પ્રાયોરીટી તેમજ મ્યુનિ.કાઉન્સીલરશ્રીઓના બજેટમાં થતા કામોના બીલ બનાવવાની બીલોની મંજુરી મેળવવાની એકાઉન્ટ્સ ખાતે ડીમાન્ડ મોકલવાની તથા ઈ.સી.એસ.થી પેમેન્ટ કરવા માટે એડવાઈઝ બનાવીને બેંકમાં મોકલવાવી પેમેન્ટ કરવા સુધીની કામગીરી કરવામાં આવે છે.

જાહેર માહિતી અધિકાર અધિનિયમ- ૨૦૦૫ હેઠળ વહીવટી શાખા ખાતે આવતી અરજી તેમજ અપીલો તે.મ્યુનિ.કમિશનરશ્રી(પૂર્વઝોન) હસ્તકના દરેક ખાતાની ત્રિમાસીક સંકલન કરી જે તે વિભાગને મોકલવામાં આવે છે.

તે.મ્યુનિ.કમિશનરશ્રી(પૂર્વઝોન)ની ઓફિસ તથા વહીવટી ઓફિસ માટેની કન્ટીજન્સીની સામગ્રી માટે સેન્ટ્રલ સ્ટોર્સથી ઈન્ડેન્ટ ભરી મંગાવવાની કામગીરી કરવામાં આવે છે.

પૂર્વઝોનમાં નિર્મણ ગુજરાત અંતર્ગત દરેક મહિનાની શરૂઆતમાં તે.મ્યુનિ.કમિશનરશ્રી (પૂર્વઝોન)ના તાબા હેઠળના દરેક ખાતાની માહિતી સંકલીત કરી જે તે વિભાગમાં મોકલવામાં આવે છે.

પૂર્વઝોન વહીવટ વિભાગમા મ્યુનિ.કોર્પોરેશનના મંજુર કરેલ અંદાજ પત્ર મુજબ જાહેર સુખાકારીને લગતાં રોડ, લાઈટ, પાણી, ગાર્ટર જેવી આવશ્યક સેવાઓના કામો કરવા ટેન્ડર, કવોટેશન, ઓફર પ્રસિધ્ય કરવાની કામગીરી કરવામાં આવે છે. કોન્ટ્રાક્ટર દ્વારા ટેન્ડર સમયે લેવામાં આવતી ટેન્ડર ફી, અર્નેસ્ટમની ડિપોઝિટની રકમ, લેવાની તથા કામ પૂર્ણ થયેથી પરત કરવાની કામગીરી કરવામાં આવે છે. તથા ૮૦/૧૦ ની સ્કીમ અંતર્ગત જાજરૂ ના ફોર્મ વેચાણ કરી તેમજ આ સ્કીમ અંતર્ગતનાબીલો બનાવીને પાર્ટીને પેમેન્ટ કરવાની કામગીરી કરવામાં આવે છે.

પૂર્વઝોન વહીવટ ખાતામાં ઝોનના જુદા જુદા વોર્ડમાં જુદી જુદી કંપનીઓના કામ કરવા માટે રોડ ઓપનીંગ માટે આપવામાં આવતી મંજુરી પરમીટ આપવાની કામગીરી કરવામાં આવે છે.

આવે છે. અને ઝોનના ઈજનેર વિભાગમાં થતા પરચુરણ કામોની બીલો બનાવીને તેનું પેમેન્ટ કરવાની કામગીરી કરવામાં આવે છે.

નિર્મણ ગુજરાત અંતર્ગત પૂર્વઝોનના ઈજનેર ખાતાના જુદા જુદા વોર્ડમાં ગરીબ કલ્યાણ મેળામાં શૌચાલય બનાવવાની કામગીરી કરવામાં આવે તેનું બીલો બનાવીને પેમેન્ટ માટે નાણાં ખાતે મોકલીને પાસ કરવાની કામગીરી કરવામાં આવે છે.

પૂર્વઝોન વહીવટી વિભાગમાં વોર્ડ લેવલે કરવામાં આવેલ કામો સંદર્ભે બીલો તથા પેમેન્ટ અંગે જે વાંધા આવે છે. તે વાંધાઓને જે તે વોર્ડમાં નિકાલ અર્થે મોકલવાની કામગીરી કરવામાં આવે છે. ઓડીટ વિભાગ દ્વારા પૂર્વઝોનના તમામ ખાતાઓના ઓડીટ ઓફ્ઝેક્શન આવે છે. તે ઓફ્ઝેક્શનના નીકાલ અર્થે જે તે ખાતાને મોકલવાની કામગીરી કરવામાં આવે છે.

| ક્રમ | નામ | હોદ્ડો | પગાર ધોરણ | અધિકારીશ્રીનો ફોન નં./મોનં |
|------|------------------------------|--------------------------|-------------|----------------------------|
| ૧ | શ્રી દિલિપ એસ.ગોર | ટે.મ્યુનિ.કમિશનર | ૩૭૪૦૦-૬૭૦૦૦ | ૮૩૨૭૦૩૮૭૨૦ |
| ૨ | શ્રી શૈલેષકુમાર બી. ભરવાડા | સ્ટેનો ટુ. ડી.વાય.એમ.સી. | ૮૩૦૦-૩૪૮૦૦ | ૨૨૮૭૦૪૨૨ |
| ૩ | જગ્યા ખાતી | આસી.મ્યુનિ.કમિશનર | ૧૫૬૦૦-૩૮૧૦૦ | ૨૨૮૭૦૪૨૨ |
| ૪ | જગ્યા ખાતી | સ્ટેનો ટુ. એ.એમ.સી. | | |
| ૫ | શ્રી કે.આર.ડાભી | આસી.મેનેજર-વહીવટ | ૮૩૦૦-૩૪૮૦૦ | ૮૩૨૭૫૫૪૮૦૮ |
| ૬ | શ્રી કમલેશભાઈ જી. પટેલ | સીની.કલાર્ક | ૮૩૦૦-૩૪૮૦૦ | |
| ૭ | શ્રી પ્રકાશચંદ્ર જે. મકવાણા | જુની.કલાર્ક | ૫૨૦૦-૨૦૨૦૦ | |
| ૮ | શ્રી કનકસિંહ ગોળ | જુની.કલાર્ક | ૫૨૦૦-૨૦૨૦૦ | |
| ૯ | શ્રી ચંદ્રકાન્તભાઈ ડી. ચૌધરી | જુની.કલાર્ક | ૫૨૦૦ ફીક્સ | |
| ૧૦ | શ્રી મહેન્દ્રભાઈ કે.પટેલ | જુની.કલાર્ક | ૫૨૦૦-૨૦૨૦૦ | |
| ૧૧ | શ્રીમહલાદસિહ એસ.સોલંકી | જુની.કલાર્ક | ૫૨૦૦-૨૦૨૦૦ | |
| ૧૨ | શ્રી શરાફતહુસેન જી.બુખારી | જુની.કલાર્ક | ૫૨૦૦-૨૦૨૦૦ | |
| ૧૩ | શ્રી ધર્મિષ્ટાબેન ડી.વરીયા | જુની.કલાર્ક | ૫૨૦૦-૨૦૨૦૦ | |
| ૧૪ | શ્રી લોકેશસિંહ એસ. ચૈહાણ | નોન.ટેક.સુપરવાઈઝર | ૫૨૦૦-૨૦૨૦૦ | |
| ૧૫ | શ્રી સુરેશભાઈ વ્યાસ | પટાવાળા | ૫૨૦૦-૨૦૨૦૦ | |
| ૧૬ | શ્રી શામજીભાઈ એસ. જાદવ | પટાવાળા | ૫૨૦૦-૨૦૨૦૦ | |
| ૧૭ | શ્રી પોલાભાઈ એમ. ચાવડા | મજૂર | ૪૪૪૦-૭૪૪૦ | |
| ૧૮ | શ્રી નારણભાઈ આર. ગોહેલ | મજૂર | ૪૪૪૦-૭૪૪૦ | |
| ૧૯ | શ્રી રમીલાબેન સોનકુસરે | મજૂર | ૪૪૪૦-૭૪૪૦ | |
| ૨૦ | શ્રી ફેલીસ આર્થિવાદ કિશ્યાન | મજૂર | ૪૪૪૦-૭૪૪૦ | |

એનેક્ષર-એ

(સામાન્ય વહીવટી વિભાગના તા.૦૧/૦૫/૨૦૦૮ ના પરિપત્ર ક્રમાંક:-પીએડી-૧૦-૨૦૦૭-૩૩૩૬૪-આરટીઆઈસેલનું ૧ બિડાણ)

પ્રમાણપત્ર

આથી પ્રમાણિત કરવામાં આવે છે કે મારી વડી કચેરી(પ્રોપર) તથા મારા વહીવટી કાર્યક્ષેત્રના આ સાથે યાદી મુજબના જાહેર સત્તા મંડળો દ્વારા માહિતી અધિકાર અધિનિયમની કલમ-૪ અંતર્ગત સ્વયં જાહેર કરવાની બાબતો (પ્રોએક્ટીવ ડિસ્કલોજર)(પીઓડી) તૈયાર કરવામાં આવી છે. અને તા.૦૮/૦૬/૨૦૧૫ની સ્થિતિએ તે અધ્યતન કરવામાં આવેલ છે જેનું અમારા દ્વારા માણ ડિસેમ્બર ૨૦૧૪ દરમ્યાન ઇન્સ્પેક્શન-કમ-ઓડિટ કરવામાં આવે છે અને જે બાબતે ક્ષતિ જણાઈ હતી અગાર તો અપૂરતી વિગતો જણાઈ હતી તેની પૂર્તતા કરવામાં આવી છે.

૧- તા.૦૮-૦૬-૨૦૧૫ની સ્થિતિએ હવે પૂર્વોન વહીવટી શાખાના પ્રોએક્ટીવ ડિસ્કલોજર (પીઓડી)નું ઇન્સ્પેક્શન-કમ-ઓડિટ બાકી રહેલ નથી.

૩. મુનિસિપલ કમિશનર(પૂર્વોન)

તારીખ:-૦૮/૦૬/૨૦૧૫

મુખ્ય મથક:-પૂર્વોન, હરુભાઈ મહેતા ભવન

વિરાટનગર, અમ. મ્યુ. કોર્પોરેશન